

VIPUL M DESAI

<http://suratiundhiyu.wordpress.com/>

હનુમાન પ્રશ્નાવલી ચક્ર: જાણો ક્યારે ચમકશે તમારું કિસ્મત



દરેક વ્યક્તિના મનમાં પોતાના ભાવિને લઈને ઘણા પ્રશ્નો હોય છે. તે હંમેશા આ પ્રશ્નોના જવાબમાં ખોવાયેલો રહે છે પરંતુ છતાં તે આ પ્રશ્નોનો જવાબ શોધવો તેના માટે ઘણો કપરો હોય છે. આવામાં હનુમાન જ્યોતિષના માધ્યમથી દરેક પ્રશ્નોના ઉત્તર સરળતાથી જાણી શકાય છે. આ આર્ટિકલની સાથે હનુમાન પ્રશ્નાવલી ચક્ર પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં તમારા પ્રશ્નોનો જવાબ છુપાયેલો છે.

### ઉપયોગ વિધિ

જેને પણ પોતાના પ્રશ્નોનો જવાબ જોઈએ તેણે સૌ પ્રથમ સ્નાનાદિથી પવિત્ર થવું.

પાંચ વાર ૐ રાં રામાય નમઃ મંત્રનો જાપ કર્યા બાદ 11 વાર ૐ હનુમતે નમઃ મંત્રનો જાપ કરવો.

તેના પછી આંખો બંધ કરી હનુમાનજીનું સ્મરણ કરતા પ્રશ્નાવલી ચક્ર પર કરસર ફેરવતા રોકી દો.

જે કોષ્ટક પર કરસર રોકાઈ જાય તે કોષ્ટકમાં લખેલા અંકને જોઈને પોતાના પ્રશ્નોનો જવાબ જુઓ.

## કોષ્ટકો ના અંક અનુસાર ફળાદેશ

- 1- તમારું કાર્ય જલ્દી પુરું થશે.
- 2- તમારા કાર્યમાં સમય લાગશે. મંગળવારે વ્રત કરવું.
- 3- દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો કાર્ય જલ્દી પુરું થશે.
- 4- કાર્ય પુરું નહીં થાય,
- 5- કાર્ય જલ્દી થશે, પરંતુ અન્ય વ્યક્તિની સહાય લેવી પડશે.
- 6- કોઈ વ્યક્તિ તમારા કાર્યોમાં અડચણો નાખશે, બજરંગ બાણનો પાઠ કરો.
- 7- તમારા કાર્યમાં કોઈ સ્ત્રીની સહાયતા અપેક્ષિત છે.
- 8 - તમારું કાર્ય નહીં થાય, કોઈ અન્ય કાર્ય કરો.
- 9- કાર્ય સિદ્ધિ માટે યાત્રા કરવી
- 10- મંગળવારનું વ્રત રાખો અને હનુમાનજીને ચોળા ચઢાવશો તો મનોકામના પુર્ણ થશે.
- 11 - તમારી મનોકામના જલ્દી પુરી થશે. સુંદરકાંડનો પાઠ કરો.
- 12 - તમારા દુશ્મનો બહુ છે. કાર્ય થવા નહીં દે.
- 13 - પીપળાના વૃક્ષની પૂજા કરો. એક માસ બાદ કાર્ય સિદ્ધ થશે.
- 14 - તમને શીઘ્ર લાભ થવાનો છે. મંગળવારે ગાયને ગોળ અને ચણા ખવડાવો.
- 15 - શરીર સ્વસ્થ રહેશે, ચિંતાઓ દુર થશે.
- 16 - પરિવારમાં વૃદ્ધિ થશે. માતા - પિતાની સેવા કરો અને રામચરિતમાનસના બાલકાંડનો પાઠ કરો.
- 17 - અમુક દિવસો ચિંતા રહેશે. ઐ હનુમતે નમ મંત્રની દરરોજ એક માળાનો જાપ કરો
- 18 - હનુમાનજીના પૂજન અને દર્શનથી મનોકામના પુર્ણ થશે.
- 19 - તમને વ્યવસાય દ્વારા લાભ થશે. દક્ષિણ દિશામાં વ્યાપારિક સંબંધો વધારો.
- 20 - ઋણથી છુટકારો, ધનની પ્રાપ્તિ તથા સુખની ઉપલબ્ધિ શીઘ્ર થનારી છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- 21 - શ્રી રામચંદ્રની કૃપાથી ધન મળશે. શ્રી સીતારામના નામની પાંચ માળા રોજ કરો.
- 22 - હમણાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પણ અંતે વિજય તમારો જ થશે.
- 23 - તમારો દિવસ ઠીક નથી. રોજ હનુમાનજીનો પૂજન કરો. મંગળવારે ચોળા ચઢાવો. સંકટોથી મુક્તિ મળશે.

- 24 - તમારા ઘરવાળા જ વિરોધમાં છે. તેમને અનુકુળ કરવા પુનમનું વ્રત કરો.
- 25 - તમને જલ્દી શુભ સમાચાર મળશે.
- 26 - દરેક કામ વિચારી - સમજીને કરો.
- 27 - સ્ત્રી પક્ષથી તમને લાભ થશે.દુર્ગાસપ્તશતીનો પાઠ કરો.
- 28 - હમણાં અમુક મહિનાઓ સુધી પરેશાની છે.
- 29 - હમણાં તમારા કાર્યની સિદ્ધિમાં વિલંબ છે.
- 30 - તમારા મિત્ર જ તમને દગો આપશે.સોમવારનું વ્રત કરો.
- 31 - સંતાનથી સુખ પ્રાપ્ત થશે.શિવની આરાધના કરો અને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરો.
- 32 - તમારા દુશ્મનો તમને હેરાન કરે છે. સોમવારે બ્રાહ્મણને ભોજન કરાવો.
- 33 - કોઈ સ્ત્રી તમને દગો આપશે. સાવધ રહેવું.
- 34 - તમારા ભાઈ - ભાંડુઓ વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે વ્રત રાખો.
- 35 - નોકરીથી તમને લાભ થશે. પદોન્નતિ સંભવ છે, પુનમનું વ્રત રાખી કથા કરો.
- 36 - તમારા માટે યાત્રા શુભદાયી રહેશે. તમારા સારા દિવસો આવી ગયા છે.
- 37 - પુત્ર તમારી ચિંતાનું કારણ બનશે.રોજ રામ નામની પાંચ માળાનો જાપ કરો.
- 38 - તમારે હમણાં થોડાં દિવસો હજી પરેશાની રહેશે. યથાશક્તિ દાન -પુણ્ય અને કીર્તન કરો.
- 39 - તમને રાજકાર્ય અને ન્યાયિક કેસમાં સફળતા મળશે. શ્રી સીતારામનું પૂજન કરવાથી લાભ મળશે.
- 40 - અતિશીઘ્ર તમને યશ મળશે. હનુમાનની ઉપાસના અને રામનામનો જાપ કરો.
- 41 - તમારી મનોકામના પુર્ણ થશે.
- 42- હમણા સમય સારો નથી.
- 43- તમને આર્થિક કષ્ટનો સામનો કરવો પડશે.
- 44 - તમને ધનની પ્રાપ્તિ થશે.
- 45 - દામ્પત્ય સુખ મળશે.
- 46 - સંતાનસુખની પ્રાપ્તિ થવાની છે.
- 47 - અભી દુર્ભાગ્ય સમાપ્ત નથી થયો. વિદેશ યાત્રાથી અવશ્ય લાભ થશે.
- 48 - તમારો સારો સમય આવવાનો છે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ મળશે.
- 49 - તમારો બહુ જ સારો સમય આવી રહ્યો છે. તમારી દરેક મનોકામના પુરી થશે.